

નાસતા ફરતા આરોપીઓ પકડવાની ડ્રાઇવ દરમ્યાન પીક પોકેટીંગના ગુનાઓમાં

નાસતા ફરતા રીઠા આરોપીને ઝડપી પાડતી સુરત શહેર ક્રાઇમ બ્રાંચ.

સુરત શહેર વિસ્તારમાં નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવા સંબંધેની ડ્રાઇવ દરમ્યાન PSI શ્રી વી.વી.ભોલા નાઓ તેમની ટીમના માણસો સાથે પેટ્રોલીંગમાં નિકળેલા તે દરમ્યાન ASI વિજયસિંહ બહાદુરસિંહ તથા PC ખુમાનસિંહ વીરાભાઈ નાઓને મળેલ બાતમી હકીકત આધારે આંજણા ફાર્મ અનવરનગર બ્રીજ નીચેથી આરોપી સહીદ ઉર્ફે આશીફ ઉર્ફે યુહા ડ/૦ નજરખાન કાદરખાન પઠાણ ઉ.વ.૨૨ રહે.ખ્વાજાનગર ઝુપડપટ્ટી ગલી નં. ૭, શકીલભાઈ કરીયાણાની દુકાનની બાજુમાં, બાખડ મહોલ્લાની પાછળ, શાસ્ત્રીનગર ખટોદરા કોલોની, સુરત. મુળ રહે. જલગાવ ગેંદાલાલ મીલ પાસે તા.જી.જલગાંવ મહારાષ્ટ્ર નાને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરેલ. તેની પુછપરછ કરતા તેણે જણાવેલ કે, આજથી આશરે આઠેક માસ પહેલા આરોપીએ માનદરવાજા ખ્વાજાનગર ગરીબ નવાજ કિરાણા સ્ટોર ખાતેથી સીગારેટ લીધા બાદ દુકાનવાળાને પૈસા નહી આપી તેમને ગાળો આપી દાદાગીરી કરી જાનથી મારી નાંખવાની ધમકી આપી ચાલ્યો ગયેલો. ત્યારબાદ આજથી આશરે ત્રણેક માસ પહેલા પોતે પોતાના મિત્ર સમીર ઉર્ફે ભાઉ રહે.ઉનપાટીયા સુરત તથા તોસીફ ઉર્ફે ૧૦૮ ગુલામ મોહમદ અંસારી રહે.ગલી નં.૫, ખ્વાજાનગર માનદરવાજા, સુરત નાઓ સાથે મળીને ત્રણેય તોસીફ ઉર્ફે ૧૦૮ ની સ્પેન્ડર મો.સા.માં સાંજના સમયે નિકળીને રીંગરોડ મિલેનીયમ માર્કેટ BSNL ઓફીસ પાસેથી એક ઇસમ સાથે અથડાઇ તેની નજર ચુકવી તેના ખીસ્સામાંથી રૂ.૩૫,૦૦૦/- કાઢી લીધેલા. ત્યારબાદ ઉપરોક્ત ગુનો કર્યાના પંદરેક દિવસ બાદ પોતે પોતાના મિત્ર રામીક ઉર્ફે રાજીક શેખ રહે.કોસંબા તથા અલ્તાફ પઠાણ રહે.ભાઠેના સુરત નાઓ પોતાની એક્સેસ મોપેડ લઇ રાત્રે દસેક વાગ્યાના સુમારે નાના વરાછા ચીકુવાડી સી.એન.જી. પંપ પાસેથી એક ઇસમ સાથે અથડાઇ તેની નજર ચુકવી તેના ખીસ્સામાંથી રૂ.૩૫,૦૦૦/- કાઢી લીધેલા. ત્યારબાદ ઉપરોક્ત ગુનો કર્યાના પંદરેક દિવસ બાદ ફરીથી પોતે પોતાના મિત્ર સમીર ઉર્ફે ભાઉ તથા તોસીફ ઉર્ફે ૧૦૮ ગુલામ મોહમદ અંસારીનાઓ ભેગા મળી ત્રણેય તોસીફ ઉર્ફે ૧૦૮ ની સ્પેન્ડર મો.સા. ઉપર બેસી રીંગરોડ મિલેનીયમ માર્કેટ BSNL ની ઓફીસ પાસેથી એક ઇસમ સાથે અથડાઇ તેની નજર ચુકવી તેના ખીસ્સામાંથી રૂ.૧,૦૦,૦૦૦/- કાઢી લીધેલા. જે ગુનાઓમાં પોતે નાસતો ફરતો હોવાની કબુલાત કરેલ હોય. જે બાબતે રેકર્ડ ઉપર ખાત્રી કરતા નીચે મુજબના સુરત શહેરના સલાબતપુરા તથા કાપોદ્રા પોલીસ સ્ટેશનના ગુનાઓમાં આરોપી નાસતો ફરતો છે.

(૧) સલાબતપુરા પો.સ્ટે. I ગુ.ર.નં.૫૬૩/૨૦૧૯ ઇ.પી.કો.કલમ-૩૭૯ મુજબ,(૨) સલાબતપુરા પો.સ્ટે. I ગુ.ર.નં. ૫૬૬/૨૦૧૯ ઇ.પી.કો. કલમ-૩૭૯ મુજબ,(૩) સલાબતપુરા પો.સ્ટે. II ગુ.ર.નં.૫૫૮/૨૦૧૯ ઇ.પી.કો. કલમ-૩૨૩, ૫૦૪, ૫૦૬(૨) મુજબ,(૪) કાપોદ્રા પો.સ્ટે. I ગુ.ર.નં.૨૫૮/૨૦૧૯ ઇ.પી.કો. કલમ-૩૭૯(એ)૩, ૧૧૪ મુજબ.

- આરોપીની મોડસ ઓપરેન્ડી:-સદર આરોપી પોતાના મિત્રો સાથે મળીને મો.સા. ઉપર બેસી સુરત શહેરના અલગ અલગ વિસ્તારોમાં ફરી જે માણસના ખીસ્સામાં રોકડા રૂપિયા હોય તેની ઉપર નજર રાખી તે માણસને ટાર્ગેટ કરી તેને મો.સા. અથડાવી તેની સાથે

બોલાચાલી કરી તેનું બીજું ધ્યાન ભટકાવી તેના ખીસ્સામાંથી રોકડા રૂપિયા કાઢી લઈ ચોરી કરી નાસી જવાની એમ.ઓ. ધરાવે છે.

• આરોપીનો ગુનાહીત ઇતિહાસ:-

(૧) ખટોદરા પો.સ્ટે. । ગુ.ર.નં.૩૨૧/૨૦૧૭ ઇ.પી.કો. કલમ-૧૧૪,૩૨૩,૩૨૪,૪૨૭,૫૦૪,૫૦૬(૨), જી.પી.એક્ટ-૧૩૫ મુજબ, (૨) ખટોદરા પો.સ્ટે. ॥ ગુ.ર.નં.૨૭૭૫/૨૦૧૮ ઇ.પી.કો. કલમ-૫૦૪, ૫૦૬(૨), જી.પી.એક્ટ-૧૩૫ મુજબ, (૩) ખટોદરા પો.સ્ટે. । ગુ.ર.નં.૫૭/૨૦૧૭ ઇ.પી.કો. કલમ-૩૭૯, ૧૧૪ મુજબ (૪) ખટોદરા પો.સ્ટે. । ગુ.ર.નં.૨૮૫/૨૦૧૭ ઇ.પી.કો. કલમ-૧૧૪,૩૨૩,૩૨૪,૫૦૪ જી.પી.એક્ટ-૧૩૫ મુજબ, (૫) ખટોદરા પો.સ્ટે. । ગુ.ર.નં.૬૬/૨૦૧૨ ઇ.પી.કો. કલમ-૩૫૬,૩૭૯ મુજબ (૬) અઠવાલાઇન્સ પો.સ્ટે. । ગુ.ર.નં.૩૪/૨૦૧૭ ઇ.પી.કો. કલમ-૩૭૯, ૧૧૪ મુજબ (૭) અઠવાલાઇન્સ પો.સ્ટે. । ગુ.ર.નં.૩૬/૨૦૧૭ ઇ.પી.કો. કલમ-૩૭૯, ૧૧૪ મુજબ (૮) અઠવાલાઇન્સ પો.સ્ટે. । ગુ.ર.નં.૫૨/૨૦૧૭ ઇ.પી.કો.કલમ-૩૫૬,૩૭૯ મુજબ (૯) સલાબતપુરા પો.સ્ટે. । ગુ.ર.નં.૩૦૨/૨૦૧૮ ઇ.પી.કો. કલમ-૩૭૯, ૧૧૪ મુજબ (૧૦) સલાબતપુરા પો.સ્ટે. । ગુ.ર.નં.૪૦૫/૨૦૧૭ ઇ.પી.કો. કલમ-૩૭૯ મુજબ (૧૧) સલાબતપુરા પો.સ્ટે. । ગુ.ર.નં.૧૯/૨૦૧૩ ઇ.પી.કો. કલમ-૧૮૮,૩૨૩,૩૨૪,૫૦૪ મુજબ (૧૨) વરાછા પો.સ્ટે. । ગુ.ર.નં.૧૨૮/૨૦૧૧ ઇ.પી.કો. કલમ-૩૭૯ મુજબ.